

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૨/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૯૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૫ કેસ કરી, ૬૭ વ્યક્તિઓને ઝડપી, ૩૯૦ લીટર દેશી દારૂ, ૫૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૯૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૨ સ્ફૂટર, ૧ રિક્ષા અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૭,૫૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૯૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૦૦/૧૮

સરદારનગર: પંખીલભાઈ શૈલેશભાઈ ગજ્જર (રહે.કેતન સોસાયટી ઉમા સ્કુલની પાસે કુબેરનગર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૨/૧૮ રાતના ૧૧/૦૦ થી તા.૧૦/૨/૧૮ સવારના ૬/૧૫ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના, બેંક કાર્ડ, ઘડીયાળ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨૭,૪૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

સોનાનુ મંગળસુત્ર ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૩૦૧/૧૮

ચાંદખેડા: અર્યનાસિંગ પ્રભાતકુમાર પ્રસાદ (ઉ.વ.૪૩)(રહે.શ્યામવેદ સ્ટેટસ માનસરોવર આઇ.ઓ.સી રોડ ચાંદખેડા) તા.૧૦/૨/૧૮ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે પાર્શ્વ રેસીડેન્સીના સર્કલ થી તેજેન્દ્રનગર વિભાગ-૦૭ ની પાછળના રોડ ની ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ અર્યનાસિંગના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ અર્યનાસિંગ પ્રસાદે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એન.કે.રાઠવા ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૦૨/૧૮

એલીસબ્રીજ: મંજુલાબહેન વા/ઓ તુલજાશંકર(ઉ.વ.૮૦)(રહે.નીલમ સોસાયટી ચંદન મેડીકલ સ્ટોરની બાજુમાં ભુદરપુરા રોડ આંબાવાડી તા.૨૯/૦૧/૧૮ કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પુજાપાઠ કરતા હતા ત્યારે દીવાની જાળથી દાઝી ગયા હતા. સારવાર માટે તેમને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૧/૦૨/૧૮ કલાક ૩/૪૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો. શ્રી પર્વતસિંહ વેચાતભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૦૩/૧૮

વેજલપુર: મકસુદાબાનુ ડો/ઓ રહીમભાઈ ચોપડા (ઉ.વ.૨૫)(રહે.આલ્ફા ડુપ્લેક્ષ ઝલક ફ્લેટ સામે વેજલપુર) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૨/૧૮ બપોરના ૧/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી "એમ" ડીવીઝન ચલાવે છે.

અમરાઈવાડી: મનીષાબહેન વા/ઓ કિશનભાઈ ચૌહાણ (ઉ.વ.૧૯) (રહે. મહાલક્ષ્મીનગર અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૨/૧૮ કલાક ૧૧/૩૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી "આઈ" ડીવીઝન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.